

આવો, ઈસુને મળો - ૧

આવો અને જુઓ – લાગા ૧

લેખક
પ્રિસ્તાનંદ
ક્રેટલિક ઈન્ડરમેશન સર્વિસ સોસાયટી
અમિબોલા બિલીંગ, સાન્માન હોટલની બાજુમાં,
ઇન્કમટેક્ષ અન્ડરપ્રિઝ ઉપર, અમદાવાદ ૩૮૦૦૧૪

ધર્મધ્યક્ષની મંજૂરી
ડૉ. ચાલ્સિંગોમ્સા, એસ. જે.
અમદાવાદના ધર્મધ્યક્ષ
૦૧-૦૧-૧૯૮૭

ધર્મધીકારીની મંજૂરી
અંતોની શંકુરિકલ, એસ. જે.
ઉપરી, ઈસુસંધ, ગુજરાત પ્રાંત
૧૬-૦૧-૧૯૮૭

સી. આઈ. એસ. એસ.
પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ - નકલ : ૨૦૦૦
પુનર્મુદ્રણ : ૧૯૮૧ - નકલ : ૩૦૦૦
પુનર્મુદ્રણ : ૧૯૮૩ - નકલ : ૫૦૦૦
પુનર્મુદ્રણ : ૧૯૮૫ - નકલ : ૧૦,૦૦૦
પાંચમી આવૃત્તિ : ૧૯૮૮ - નકલ : ૧૨,૦૦૦
છાટી આવૃત્તિ : ૨૦૧૩ - નકલ : ૧૦૦૦
સાતમી (સુધારેલી) આવૃત્તિ : ૨૦૧૪ - નકલ : ૨૦૦૦

પ્રકાશક : વર્ગીસ પોલ, એસ. જે.
ક્રેટલિક ઇન્ફરમેશન સર્વિસ સોસાયટી
અમિબોલા બિલ્ડિંગ, સાન્માન હોટલની બાજુમાં,
ઇન્કમટેક અન્ડરબિજ ઉપર, અમદાવાદ ૩૮૦ ૦૧૪

મુદ્રક :
આશંક પ્રેસ, ગામડી - આશંક ૩૮૮૦૦૧
ફોન : ૦૨૬૫૨-૨૫૩૮૩૩, ૨૫૬૬૫૦

પ્રકરણ - ૧

આવો અને જુઓ

ઈસુ જગતના સૌથી મહાન ગુરુ છે. એમનાં જીવન તથા વિચારોએ દુનિયા પર જબરજસ્ત અસર કરી છે. ઈસુએ માનવજીવનમાં પ્રેમની અનોડ કાંતિ કરી છે. આવા ગુરુને ચરાળે બેસવાનું તથા એમનાં વચનામૃતો સાંભળવાનું કોને મન ન થાય?

ચાલો, આપણો આપણા જીવાએ ઉપડીએ ને ઈસુ પાસે પહોંચી જઈએ. આપણો બે હજાર વર્ષોની લાંબી મજલ કાપવાની છે ને એક નાનકડા દેશ પાલેસ્ટીનમાં જવાનું છે.

આ જુઓ, આપણે પહોંચી ગયા. જુઓ, સામે એક મોટું ટોળું છે. એ ટોળામાં ખેતરે દા'ડીએ જતા મજૂરો છે. સુથાર, લુહાર, વજાકર, મોચી જેવા કારીગરો છે. નાની હાર્ટીઓ માંડી બેઠેલા દુકાનદારો છે. ખૂમચા લઈને ફરનારા ફેરિયા છે. જમીન બેડી ખાતા બેદૂતો છે. મોટા ભાગના બધા અદના ગરીબ લોકો છે. એમાં થોડી જુવાનડીઓ ને ઘરડી તોસીઓ પાણ છે. એવા એ ટોળા વચ્ચે એક માણસ બેઠો છે.

એ ટોળાથી થોડે છેટે એક ટોળકી ઊભી છે. એ લોકો ધાજા ધમંડી છે. પેલા ટોળા ભણી ને એની વચ્ચે બેઠેલા પેલા આદમી ભાડી તેઓ નફરતથી જોઈ રહ્યા છે.

એ ટોળકીમાંનો એક જાણા ભવાં ચઢાવીને મોટેથી બોલે છે: ‘જુઓ આ ભામટો, હલકાં લોકોની જોડે હરતોફરતો ને ખાતોપીતો! લાજશરમ વગરનો!’

ખોવાયેલું ધેટું

ટોળા વચ્ચે બેઠેલો આદમી આ કડવાં વેણ સાંભળે છે. એમનાં ધમંડ અને અભિમાન એ પારએ છે ને પછી એમનાં કવેજાનો જવાબ આપવા માગતો હોય એમ તે પેલા ટોળા આગળ આ કથા માર્દી છે:

‘ભાઈઓ મારા, ધારો કે તમારામાંથી કોઈ જણ પાસે સો ઘેટાં છે. હવે ધારો કે એમાંનું એક ધેટું રવાડે ચુચું ને ભાગી ગયું. એ નવ્વાજું ઘેટાંવાળો માણસ શું કરવાનો? એ બાકીનાં નવ્વાજુંને વગડામાં રેઢાં મેલીને પેલા એક ઘેટાની ભાળ મેળવવા ને એને પાછું લાવવા પોતાની કહિયાળી ડાંગ લઈ જરૂર ઉપડવાનો. એ ભટકેલ ધેટું એને મળે ત્યારે શું એ એને ડાંગ વડે મારવાનો? ના, એ તો હરખપદૂતો બનીને એને ખબે બેસાડી લેશે, પાછું ધેર જઈ આવશે ને અડોશીપડોશી સૌનો કહી વળશે: ‘ભાઈલાઓ, જહયું! મારું એક ખોવાયેલું ધેટું જહયું!’

‘મારે આ જ વાત તમને સૌનો કહેવાની છે. હુંય આવા વંઠી ગયેલા લોકોની ભાળ કાજે આવ્યો છું જેમને પશ્ચાતાપની લગરિ જરૂર નથી એવા નવ્વાજું પુણ્યશાળી માણસો કરતાં પસ્તાવો કરીને પાછા આવતા એક પાપીજનને જોઈનેમારા પિતાની છાતી આનંદથી ગજગજ ઉછળે છે.’

આપણે સૌ કંઈ સાંત થોડા જ છીએ? આપણે હેયે કંઈકે સાત વસ્તું હોય તો આપણે કબૂલ કરવું પડે કે આપણે ખરેખર પાપીજનો છીએ. મને ખબર છે કે મેં ધારીય વાર ના કરવા જેવું કર્યું છે ને મને એનીય ખબર છે કે મારી આ બદટાર હાલત ભાડી હું હંમેશા આંખ આડા કાન કરતો હું છું છું, ને એ ઠીક નથી.

મેં કશુંક ખોટું કર્યું હોય એવી પળોનો હું વિચાર કરું: મેં કોઈને અન્યાય કર્યો હોય કે કોઈને છેતર્યો હોય, હું જુદું બોલ્યો હોઉં કે કોઈને જોડે મેં હલકો વતર્વિ કર્યો હોય; જોમને આવાં કામો બદલ અફ્સોસ થતો હોય તો પછી પેલા ખોવાયેલા ઘેટાને શોધવા નીકળી પડતા ને એને પાછું લાવીને રાજીરેડ થયેલા પેલા ભરવાડનું ચિત્ર મારા દિમાગનો કબજો જમાવ્યા વિના ના રહે.

બીજી બાજુ, જો મને એમ જ લાગતું હોય કે મેં કંઈ અવળું કામ કર્યું જ નથી, ને મને એવો કથો વસવસો થતો જ નથી, મારાં પુણ્યની જોરે મારી મુક્તિ હું મારી જાને મેળવી શકું એમ છું ને મારે એમાં કોઈના ટેકાની જરૂર નથી. જો આવું જ હોય તો પછી બહેતર છે કે હું આ વાતને જ પડતી મેલું. જો એમ જ હોય તો આ ચોપડી મારા માટે નકામી છે. કારણ, એમાં મારે લાયક કોઈ સંદેશો છે નહીં.

લ્યો, પેલા ટોળા વચ્ચે બેઠેલા આદમીને ઓળખો. એ ઈસુ છે. ઈસુ એમને બીજી એક કથા કહી રહ્યા છે. એ વાતનો જોટો જરે એમ નથી. અસલ માણસની જ વાત છે. મારી, તમારી આપણા દરેક જગની વાત છે.

સાંભળો એ વાતા:

એક હતો બેડૂત. મોટાં ખેતરો અને ખોરડાંનો ધાડી. એને બે દીકરા. મોટો કહ્યાગરો ને કામદો. નાનો છેલધોગાળો ને તોરીલો. એક દહાડો નાનો બાપની પાસે ગયો અને બોલ્યો: ‘બાપા, મારોને ભાગ થતો હોય તે કાઢી આલો.’ બેટો એકનો બે ના થયો એટલે બાપે પોતાની મતા બેઉ દીકરા વચ્ચે સરખે ભાગે વહેંચી આપી. પછી નાનો તો નાણાંની કોથળીઓ ભરીને પરદેશ ઉપડી ગયો. ત્યાં એણો એલ કર્યા, ફેલ કર્યા. બધી સંપત્તિ વેડ્ફી નાખી ને છેવટે ખાલીખમ થઈ ગયો.

એવામાં એ દેશમાં દુકાણ પડ્યો ને ખાવાના વખા પડ્યા. ભૂખે મા રહેવાયું એટલે નાનો એક માણસ આગળ કરગરી પડ્યો.

‘બાપા, મારાં ભૂંડ સાચવીશ?’ પેલા માણસો કહ્યું.

‘બાપા, જે કહો તે કરેશ.’

નાનો દીકરો ભૂંડ સાચવવા લાગ્યો ને ભૂંડ જે ખાય તે ખાઈનો પેટ ભરવા લાગ્યો. ત્યારે એને પોતાનો બાપ સાંભળ્યો:

‘મારા બાપને ઘેર કેટકેટલા નોકર્યાકર છે. એમને મારા બાપ હેતેહેતે પેટ ભરીને ખવડાવે છે ને અહીં હું ભૂખે મરું છું.’

નાના દીકરાને ધાજો પસ્તાવો થયો. એ મનોમન બોલ્યો: ‘હે જીવ, આ ચાળા પડતા મેલ ને થા ધર ભેળો, જેઈને દેવ જેવા બાપને પગે પડ ને એમને કહે કે, તમારો દીકરો કહેવડાવવા તો હું લાયક રહ્યો નથી. પાણ મને તમારો ચાકર રાખો ને તમારે આશરે રહેવા દ્યો.’ પછી એ ઉપડ્યો ને પોતાના બાપના ધરને રસ્તે પડ્યો.

બાપે દીકરાને દૂરથી આવતો જોયો ને ઓળખ્યો. પોતાના ચીથેરેહાલ દીકરાને જોઈને બાપની આંખો ભરાઈ આવી. બાપ દીકરા સામે દોડ્યો ને એને બાથમાં લઈ લીધો. દીકરો, ‘બાપુ, મૈં ભગવાનનો ને તમારો અપરાધ કર્યો છે, તમારો દીકરો કહેવડાવવા તો હવે હું લાયક રહ્યો નથી,’ એવું બોલવા ગયો પાણ બાપે એને બોલવા જ ના દીધો ને પોતાના ચાકરોને તે હુકમ આપવા લાગ્યો. લાવો, મારા દીકરા સારુ નવાંનકોર અંગરખાં લાવો. એને આંગળીએ વીંટી ને પગે મોજડીઓ પહેરાવો. ધેર ધેર ગોળધાજા વહેંયો ને મોટો જમણવાર માંડો. કારણ, મારો આ દીકરો ખોવાણો હતો તે પાછો જર્યો છે. મૂઆ બરાબર હતો તે પાછો જીવતો આવ્યો છે.’

વાડીએથી પાછા ફરતા મોટા દીકરાએ ધેર શોરબકોર થતો સાંભળ્યો ને જાકજમાળ થયેલી ભાળી. એક ચાકર પાસેથી બધી વાત એણે જાણી ને વાત સાંભળીને એ ધૂંઆપૂંઆ થઈ ગયો. મોટો દીકરો ધૂંધવાઈને બોલ્યો : ‘બાપા, આજ લગી મૈં તમારું વેજા ઉથાયું નથી ને એક ચાકરની પેટે તમારું વૈતરું ફૂટચું છે. છતાં કોઈ દિ’ મારા બેચાર મળતિયા ને ઓળખ્યીતાઓને ધેર બોલાવી તમે ચા પાણી કરાવ્યાં નથી. ને બધું ધૂણધાજી કરી આવેલા આ અકુરમીને એક તો તમે ધરમાં ઘાલો છો, ને પાછો ઉપરથી જલસો રાખો છો?’

બાપ મોટા દીકરાને વાંસો હાથ મૂકી હેતથી બોલ્યો: ‘બોટા, તું હંમેશા મારે પડખે રહ્યો છે ને આ જે બધું છે તે તારું જ છે. પાણ તારો નાનો ભાઈ મરી ગયો હતો તે ફરી જીવતો થયો છે. ખોવાઈ ગયો હતો તે પાછો જર્યો છે. એટલે આ આનંદોત્સવ આપણે કરવો જ જોઈએ’ (લૂક ૧૫ : ૧૧-૩૨).

ઉપલી વાત-મારી વાત

નાના દીકરાના ભિગ્રો તો બધા તાળીભિગ્રો હતા. નાના દીકરાનાં બિસ્સાં ખાલી થયાં તે જ ધડીએ એને પડતો મૂકીને તેઓ ચાલતા થયા. નાનો દીકરો એકલો પડી ગયો. ખોટું કરનાર દરેક જાજા આ કારમો અનુભવ કરે છે. પોતે એકલો પડી ગયાની લાગણી અનુભવે છે. ને આપણામાંથી કોઈ જણ છાતી ઠોકીને એવું કહી શકશે ખરુંકે મેં કદી ખોટું કર્યું જ નથી...?

હું પાપ આચરું છું તે જ ધડીએ બધાથી વિખૂટો પડી જાઉં છું. બધા મારાથી આધા ભાગે છે, કોઈ મારી પાસે હૂંકતું નથી. કોઈ મારી દરકાર કરતું નથી. પેલા નાના દીકરાએ કેવાં એકલા એકલા ભૂડો ચાર્યા હશે ને તરછીડાયાની કેવી વસમી વેળા એના પર આવી હશે એનો હવે મને બરાબર ઝ્યાલ આવે છે. એ સાંદર્તર એકલો પડી ગયો હતો ને એમાં એનો જ વાંક હતો. પોતાનાં કર્યા ભોગવતો હતો.

ભર્યુભાઈર્યુ પોતાનું ધર એણે જાતે છોડચું હતું, વહાલસોયા બાપને એણે પોતે હડસેલો માર્યો હતો. એણે પોતાની મેળે પેલા દોસ્તો કર્યા હતા. નાના દીકરા પર એને લેશ ભાવ નહોતો એ બધા તો એના પૈસાના સગા હતા. હવે તેઓને એની શી ગરજ હતી? હવે પાછલ રહી ગયો હતો પેલો એકલો, અટૂલો ને અસાહાય મૂરખો. એનું નાખ્યોદ વળી ગયું હતું.

તો આ છે પાપ, મારું પોતાનું જ કામ. મારું જ કુકર્મ. મારા પ્રેમાળ પિતા ઈશ્વર ભાગી હું પીઠ ફેરવું છું ને મન ફાવે તે કરું છું. છેવટે મને માલૂમ પડે છે કે મારી વાહ વાહ કરનારા કાંઈ મારા વાલેશરીઓ નહોતા. તેઓ તો કશી લાલચે મારી પાસે આવ્યા હતા. એમણે તો મારો ઉપયોગ કરીને લહેર કરી લીધી. હું આવું આવું વિચારવા લાગું છું એટલે હું સાવ એકલો પડી ગયો છું. એનું મને ભાન થવા લાગે છે. પેલા છેલછોગાળા જવાનિયાની પેઠે પાપ આચર્યા બાદ હું ભારે હીણપત ને નાનામ અનુભવું છું.

પાપ એ મોત બરાબર છે. મોત જીવનનો અંત લાવે છે, પાપ ઈશ્વર સાથેના મારા સંબંધનો અંત આણે છે. પાપ બીજા માણસો સાથેના મારા છેડા ફાડી નાખે છે. પાપ મને ઈશ્વર તથા માનવ બંધુઓથી સાવ અલગ પાડી ટે છે. પાપ આચરનાર માણસ પાસે ચકલુંય ફરકતું નથી. પાપી માણસ સાવ એકલો પડી જાય છે.

એકલા પડવામાં ને એકલા પડી જવામાં ફેર છે. કોક કોકવાર આપણાએ એકલા પડીએ એ સારું છે. એ આપણાને જતતપાસ કરવાનો મોકો આપે છે. પાળ બધાથી હંમેશને માટે એકલા પડી જવું એ તો અસહા છે.

કેદખાનામાં કેદી માટે આકરામાં આકરી સન્ન કઈ? જાણો છો? કેદીને ‘અંધારી ખોલી’માં પૂરી ટેવો એ સૌથી આકરી સન્ન છે. અંધારી ખોલીમાં એક બાકોરું હોય, એમાંથી કેદીને એની ખાવા-પીવાની ને બીજી હાજરો પૂરી પાડવામાં આવે એટલું જ. પાળ એ ની જોડે કોઈ જરાય વાત ના કરે. આમ દિવસોના દિવસો કેદીને સાવ એકલો પાડી ટેવામાં આવે. આવી દશામાં ભવભલા મજબૂત મનાનો આદમી ભાંગી પડે ને ગાંડો થઈ જાય. પાપ તો આ અંધારી ખોલી કરતાંય બદટાર છે. પાપ એવું બેંકાર અંધારું છે જે મારા દિલને આખેઆખું ભરખી લે છે.

ધર્મનો અભ્યાસ

કોકને પાપનું આ ચિત્ર કદાચ ઘેરા રંગોવાળું લાગે. પાળ હું એક પાપીજના છું એ સત્ય મારી આગળ બરાબર સ્પષ્ટ થઈ જવું જોઈએ.

કેટલાક જાળ એવા છે જેમનો ધર્મનો અભ્યાસ કરવો ગમે છે. તેઓ ધર્મની થોકબંધ ચોપડીઓ વાંચે છે ને ધર્મ વિશે જેટલું મેળવી શકાય તેટલું જ્ઞાન મેળવે છે. આવો અભ્યાસ નકામો છે એમ તો કોઈ ના કહે; પાળ આવા પ્રકારના અભ્યાસમાં એક જોખમ રહેલું છે એ સમજી લેવું પડે. ગાળિત, ભૂગોળ, અંગ્રેજી જેવા વિષયોનો અભ્યાસ અને ધર્મનો અભ્યાસ એબો વચ્ચે ફેર છે. ધર્મનો અભ્યાસ બીજા વિષયોના અભ્યાસની પેઠે કરી ના શકાય. ધર્મ એ મારા આખા જીવનને આવરી લેનારો વિષય છે. ધર્મ અને મારા જીવનો અર્થ અનો હેતુસમજાવે છે. હું કોણ છું? કયાંથી આવ્યો છું? કયાં જવાનો છું? આમ ધર્મ મારી પોતાની વાત બાને છે. તેથી ધર્મના અભ્યાસના કેન્દ્રમાં તો બે જાળ જ છે - એક ઈશ્વર ને બીજો હું પોતે.

અંગ્રેજી ને ગાળિત જેવા વિષયોનો અભ્યાસ જરૂરી ને ઉપયોગી છે તો ખરો. એ પેટની ભૂખ ભાંગે ને મનાની ભૂખને પાળ સંતોષે. પાળ અંતરની ભૂખનો-આત્માની ભૂખનો તો એ કદીય ઢારી ના શકે. હું કોણ છું ને શા માટે જીવું છું એનું જ્ઞાન ને ભાન તો એ ને કરાવી ના શકે. એટલા જ માટે આપણા નરસિંહ મહેતા જેવા સંતે ભગવાનના પ્રેમરસના અનુભવનો મોટો ગણ્યો છે ને જ્ઞાનના ટુંપણાને તુચ્છ ગણ્યું છે.

આપણે આ ચોપડીમાં પાપ તથા મૃત્યુ વિષે, ઈશ્વરની ક્ષમા તથા કર્મા વિશે, આત્મા અને માનવજીવનના અર્થ વિશે વાતો કરવાની છે. એ નથી ગળિંતનો દાખલો ગાળવા બરાબર, નથી બીજા લોકોની કથા માંડવા બરાબર, કે નથી કશી માહિતી આપવા બરાબર. આપણે અહીં બરાબર મારી તથા તમારી વાત કરવાના છીએ. હા, મારી વાત. મારા જીવનમાં પાપ અને મૃત્યુની વાત. ઈશ્વરની ક્ષમા અને ઈશ્વરના પ્રેમની વાત. મારા આત્માની તથા મારા જીવનના અર્થ વિષેની વાત આવી આખી વાત સીધેસીધી મને જ લાગુ પડનારી વાત છે.

આ વાત જે હું પહેલેથી જ બરાબર સમજ લઈ તો આ નાની ચોપડી મારા માટે અત્યંત ઉપયોગી ને લાભદાયી નીવડ્યે. આ ચોપડી મારી આગળ મારા જીવનમાં ઝડપવા જેવું એક બીજું ઝડપવાનો પડકાર ફેંકશે. અન્યથા હું ગળિંતના દાખલા ગાળવા બેસું એ જ મારા માટે બહેતર છે. શા માટે નાહકનું માથું પકડવું? શા માટે એશથી ના જીવવું? ગળિંત કાંઈ મારી આગળ જીવનનો મૂળભૂત પડકાર કાંઈ ઓછું જ ફેંક છે? ગળિંત કાંઈ મને ઓછું જ કહે છે કે મારું આખું જીવન એક કૂટ કોયડો છે ને એ કોયડો ઉકેલવો એ જ માનવ તરીકે મારું ખરું કર્તવ્ય છે?

ખરું પૂછો તો ધર્મનો સાચો અભ્યાસ ને આત્માને હયમચાવી નાખનારી ચીજ છે. કારણ, ધર્મનો સાચો અભ્યાસ પુરુષ હો કે સૌ સૌ કોઈને ઉપર ઊંઠવા માટે, આત્મોનતિ સાધવા માટે પડકાર ફેંક છે. ઈશ્વરનું યથાર્થ જ્ઞાન કેવલ ધર્મના અભ્યાસને માટે જ શક્ય છે. ઈશ્વરના પ્રેમની ખરી ખબર આપણને ધર્મના અભ્યાસ મારફતે જ પડે છે. કદાચ આ સાધનોમાં આપણને કશો મોટો ભોગ આપવો પણ પડે એવો ભોગ આપણે ખુશીથી આપીએ. કારણ, એમાંથી થનારી પ્રાપ્તિ ઘણી મોટી છે. ‘આ મનખો ના મળે વારંવાર’ એવું આપણા એક ભક્તે ગાયું છે. ઈશ્વરે આપણાને સૌને દુર્લભ એવો મનુષ્યનો અવતાર આપ્યો છે. આપણો અવતાર એણે ન જાય એ સારું આપણે ધર્મના સાચા અભ્યાસ ભણી વળવું જ જોઈએ.

આવો અને જુઓ ભાગ-૨

ભૂડો ચારનારો પેલો વઠેલો દીકરો આપણાથી અજાણ્યો રહેતો નથી. કારણ, આપણે દ્રેક જણ એ દીકરાને જોતાંવેંત પોતાની જતને કહેવા લાગીએ છીએ કે, એ વઠેલો દીકરો બીજો કોઈ નહિ હું પોતે જ છું. એની વાત એ મારી જ વાત છે. મેં વારંવાર મારા વત્સલ પિતા ઈશ્વરને છેહ દીધો છે.

એટલે વઠેલા દીકરાની વાતાનો પહેલો ભાગ મને જ લાગુ પડે છે. વઠેલા દીકરાના ઉપરા-ઉપરી વાંકગુના ને મારાં પાપ. બેથ સરખાં: પાજ એ વાતાનો બીજો ભાગ પાજ મને લાગુ પડે છે એમ કહેવાય ખરું? એમાં તો પોતાના પિતા ભાડી વઠેલા દીકરાના પાછા વળવાની ને પિતાએ એને આપેલી માઝીની વાત આવે છે. આ પાજ મારી જ વાત છે એમ શું મારાથી કહેવાય ખરું? આવું માનવું અધરુંતો છે જ.

મારા મનમાં શંકા જાગે છે: શું ઈશ્વર મને માફ કરે છે? શું ઈશ્વર મને પાછો અપનાવશે? મારી જોડે ફરી સંબંધ બાંધશે? આ જાણવા માટે મારે ધર્મના સાચા અભ્યાસ ભાડી વળવું રહ્યું. હું ખંતે અભ્યાસ કરીશ, સાથે સાથે ઈશ્વરને દિલથી પ્રાર્થના પાજ કરીશ કે તેમને પ્રકાશ આપે ને સાચો રસ્તો દેખાડે. માનવી તરીકે મારો સ્વભાવ છે જે અવળયંડો. સાચું હોય એ હું સહેલાઈથી ના માનું. વળી જેમ જેમ મારાં કુકર્મ-મારાં પાપ મારી નજરમાં આવતાં જાય તેમ તેમ મારી આસ્થા ઉગતી જાય, મને એમ લાગવા માર્દિકે મારાં આટાટલાં અધમ કૃત્યોને ઈશ્વર કદી જતાં કરે ખરો? મને કદી માફ કરે ખરો?

નિષાર્થિક પણ

પેલા વઠેલ દીકરાના જીવનમાં એણે નિષાર્થિકપણ આવી હતી. ખરેખર તો એ પળે જ એને ઉગારી લીધો. એના જીવનની એ જ પળે એને ભાન થયું કે પોતે બદતર દશામાં આવી પડ્યો હતો ને સાવ એકલો પડી ગયો છે. એ વઠેલો હતો ખરો છતાં એને ઈશ્વરમાં આસ્થા હતી. એણે પોતાની જત સાથે કબૂલ કરી દીધું કે પોતે હાથે કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. પોતાની દુર્દશાનું કારણ ખુદ પોતે જ છે.

અગાઉ એણે આવો વિચાર નહોતો કર્યો. અગાઉ તો એ પોતાના તુકાઓમાં રાયતો હતો. ભાતભાતના ઇંદ્ર ચુદ્યો હતો. ને વખા પાડ્યા ત્યારે પેટ ભરવા હવાતિયાં મારતો હતો. ખરેખર તો પોતાનું જીવન કર્દ દિશામાં જઈ રહ્યું છે તેનો એણે ક્યારેય જરા થોભી જઈને વિચાર સરખો કર્યો નહોતો.

ન માની શકાય એવી વાત

પાજ છોકરો જયારે ભૂડોની વચ્ચે લમણો હાથ દઈને બોઢો હતો ત્યારે આસ્ટો આસ્ટો એને પોતા વિશે સાચું ભાન થયું. પોતે શું ગુમાવી બોઢો છે એનો એને ખ્યાલ આવ્યો. એ પળે સત્ય એની મોઢામોઢ ઊભું હતું. એના જીવનના વરવા સત્યે એને ચોખ્યું ને સીધું જોતો કર્યો. એને પોતાના પિતાની ભલાઈનું ને એમના વાત્સલ્યનું ભાન થયું, પોતાની મૂખ્યમાંની ને નાલાયકીની એને જાણ થઈ.

અને એણે નિઃરૂપ કર્યો: પોતે ઘેર પાછો જશે ને પિતાને પગે પડીને કહેશે કે મને તમારા નોકર તરીકે તમારી ॥સે રહેવા દો. પોતે પિતાને સાચ્ચાઈથી ને નિખાલસપાગે કહેશે, ‘પિતાજી, મૈં તમારો ને ઈશ્વરનો અપરાધ કર્યો છે. મારાં કુકર્માને લીધે તમારો દીકરો તો હું મટી ગયો છું, પાણ મને તમારો એક ચાકર ગાળજો.’

ધર ભાણીની એ વાટ નાના દીકરાને કેટલી વસામી લાગી હશે! એકબે વરસ પહેલાં એણે પિતાના ધરને રામ રામ કરી આ જ વાટ પકડી હતી. પોતે શું કરી બેઠો છે એનું હવે એને ભાન થયું હતું. પોતાની બોવકૂફીનો એને પૂરો ઝ્યાલ આવી ગયો હતો. પાણ આ તો રંડચા પછીનું ઉહાપાણ! હું પાણ થોડો થોબું. મૈં જીવનમાં જે કાંઈ ખોટું કર્યું હોય તેનો વિચાર કરું. આગળ શું બનશે એ વિચારે નાનો દીકરો સાચિત ને ભયભીત થયો હતો. હુંય એની મનોવૃત્તિ ધારણ કરું ને એની જોડે ચાલવા લાગું.

વાટ જોતો ઈશ્વર

પાણ નાના દીકરાની ચિંતા ને મૂંઝવાળ અસ્થાનો હતાં. એનો ભય નકામો હતો. બાપ તો કયારનોય એણે ધર છોડ્યું તે ઘડીથી એના પાછા આવવાની વાટ જોઈ રહ્યો હતો. અચંભામાં ગરકાવ કરી દે એવી વાત! પાણ એ જ સાચી ને ખરી વાત છે. ઈશ્વર કાગડોને આપણી રાહ નુએ છે. આપણાં કુકર્માનો આપણાને પસ્તાવો થાય, આપણી મૂખ્યાંનું આપણાને ભાન થાય ને આપણો પાછા વળી આપણા વત્સાલ પિતાની છાતીમાં લપાઈ જઈએ એ સારુ એ પોતાના હાથ પસારી અહર્નિશ ખડો છે.

ઈશ્વર તો આપણાને મળવા સામો દોડી આવે છે. એ આપણાને એક શબ્દ સુધ્યા બોલવા દેતો નથી ને આપણાને પોતાના આર્લિંગનમાં જકડી લે છે. આપણી તમામ ભૂલો માફ કરી દે છે. આપણાને ફરીથી પોતાનો વહાલસોયો દીકરો બનાવી દે છે.

જેમને પશ્ચાત્તાપની જરૂર નથી એવા નવ્યાળું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાત્તાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે.’

આ જ વાત ઈસુ આપણાને કહેવા માગે છે. આ જ વાત કહેવા તોમણે આપણી મધ્યે અવતાર લીધો છે. અલબત્તા, વઠેલા દીકરાની વાર્તા અટ ગળે ઊતરે એવી નથી. એ નાનો દીકરો તે હું જ છું. આ વાત માનતાં મારું મન અચકાય છે. નાના દીકરાને માફ કરી દેનારો પિતા એ મારોય પિતા છે એ હું આસાનીથી કેવી રીતે માની શકું?

આ સારું મારે વધુ વાચન કરવું પડશે. ઈસુ વિશે મારે વધારે જાળવું પડશે. ઈસુ પર મારે શ્રદ્ધા રાખવી તે મારે નક્કી કરવું પડશે. ઈસુએ જે કાંઈ કહ્યું છે તે મારે સાંભળવું પડશે ને એમણે જે કાંઈ કર્યું તે વિશે મારે વિચાર કરવો પડશે. મારે માટે ઈસુનો કોઈ સંદેશો છે ખરો એ જાળવા માટે હું પૂરો પ્રયત્ન કરીશ.

તમે આ પુસ્તિકાઓ ધ્યાન દઈને ને રસથી વાંચનો. ને જેમ જેમ વાંચતા જાઓ તેમ તેમ તે વિશે મનના કરતા રહેનો. એમાં તમારે માટે કોઈ સંદેશો છે કે નહિ અથવા એમાં તમારી પોતાની જ વાત આલેખાયેલી છે કે નહિ એ તમે જ નક્કી કરનો.

આ તબક્કે તો તમે ભગવાનને માથે રાખીને તમારી જતાને આ પ્રશ્નોનો ઉત્તર વાળજો: ‘હું મારા ઈશ્વર પિતાથી ખરેખર વિમુખ બન્યો છું?’ ‘પેલા નાના દીકરાની પેઠે હું એકલો પડી ગયાની ને દુઃખની લાગણી અનુભવું છું?’

સાથોસાથ તમે ધરિથી મનમાં આ પ્રાર્થના કરતા રહેજો:

હે દ્યાળુ પ્રભુ, મનો મારી જતનું સાચું ભાન કરાવો.
હું પોતે જેવો મને ધારું છું તેવો નાહિ
પાણ હું ખરેખર જેવો છું તેવો જોતાં મને શીખવો.

પ્રકરણ - ૪

ઈસુની પ્રેમલીલા

‘અભિલ બ્રતાંડમાં એક તું શ્રીહરિ,
જૂનવે રૂપ અનંત ભાસો.’

- નરસિંહ મહેતા।

ઈશ્વરની પ્રેમલીલા

આપણા જ્ઞાની કવિ અખાએ પરમાત્માને ‘બાવન બાહેરો’ કહ્યો છે. પરમાત્મા આપણા બાવન અક્ષરોની બાહાર છે. અર્થાત્ માનવવાણી પાસે પરમાત્માનું પૂરું વાળન કરવાનું ગણું નથી. ઈશ્વર ધારો મહાન છે. માનવબુદ્ધ એનો પૂરો પાર પામવા અસમર્થ છે. છતાં આપણી અલ્પ મતિથી ને આપણા કાચાપોચા શબ્દોથી એની કંઈક આંખી આપણે કરી શકીએ છીએ એ પરમાત્માની મહેરબાની છે.

ઈશ્વરની ઓળખ મેળવવામાં ઈસુએ આપણાને ખૂબ મદદ કરી છે. ઈસુએ પોતાના પરમ પિતા વિશે સાતત આપણી જોડે વાતો કરી છે. ખુદ એમણે પોતાને પરમ પિતા પરમેશ્વરના પુત્ર ગણાવ્યા છે. પિતાપુત્રના આ અદ્રેત વિશે આપણે પાછળથી વાતો કરીશું.

અહીં તો આપણે અગાઉથી કહ્યું છે તે મુજબ એટલું જ કહીશું કે ઈશ્વરનો આપણા પિતા તરફિ ઓળખવા અને એમનો પિતા કહી બોલવવા એ આપણા માટે સાહજ છે. આપણે એક અદ્ભુત વિશ્વમાં વસીએ છીએ. આ વિશ્વની રચના કેવી અજોડ છે! કેવી અજબ છે એની સમતુલ્યા! એનું આખું તંત્ર કેવું નિયમબદ્ધ છે! છતાં અમુક માણસો એવા છે જેઓ એમ કહે છે કે ઈશ્વર નથી. ખરું પૂછો તો આવા નાસ્તિક માણસોએ સૌ પ્રથમ પોતાની સામેના વિશ્વ વિશે કદી ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હોતો નથી.

બધું પોતાની મેળે?

કિર્યનર નામનો એક પ્રભ્યાત ખગોળશાસ્કી થઈ ગયો. એનો એક મિત્ર નાસ્તિક હતો. એ નાસ્તિક મિત્ર કિર્યનરને હંમેશા કહેતો કે ઈશ્વર છે એવું પોતે માનતો નથી. કિર્યનરે વિચાર કર્યોકે આવા તરંગી માણસ જોડે વિવાદ કરવો નકામો છે. પોતાના મિત્રની સાન ઠેકાણે લાવવા કિર્યનરે એક સીધોસાદો કીમિયો જ વિચારી કાઢ્યો. એમણે આપણી પૃથ્વીનો એક ખૂબ સુંદર ગોળો બનાવ્યોને પોતાના મેજ પર ગોટિયો. બીજા દહડે પેલો મિત્ર આવ્યો ત્યારે તે જ મેજ પરનો સુંદર ગોળો જોઈ મોંમાં આંગળાં નખી ગયો. એણે લાગલો જ સવાલ કર્યો: ‘કેટલો સુંદર ગોળો! કોણે બનાવ્યો?’

‘બનાવે કોણા?’ કિર્યનર બોલ્યા: ‘આપમેળે બન્યો!’

બંને જણા પેટ પકડીને હસ્યા. પછી કિર્યનર બોલ્યો : ‘તને મારી હંગધડા વગરની વાતથી હસવું આવ્યું. પણ ભાઈલા, તું કહે છે એમ આ આપણી આખી પૃથ્વીનો ગોળો જો એમ ને એમ બન્યો હોય તો પછી આ નાનું

રમકું એમ ને એમ બન્યું એવું કહું તેમાં તને હસવું શેનું આવે છે? મારી વાત તને ગપગોળો લાગતી હોય તો પછી તારી વાત કેવી?’

જાણીતા જીવશાસ્કી એડવીન કોન્લીને પાણ આ જ વાત જો જુદી રીતે કહી છે : ‘ને છાપખાનામાં આખો શબ્દકોશ આપોઆપ તૈયાર થઈને બહાર પડે છે એવી સંભાવના ખરી લાગતી હોય તો આખી જીવસૂષિ કોઈના નિમાણ વિના એક ધડકે પેદા થઈ શકે છે એવી સંભાવના કરવામાં વાંધો નથી.’

રોજ રોજ પરચા

માણસા તો ‘ચમત્કાર ત્યાં નમસ્કાર’માં માનવાવાળો છે. જે એ પરચાનો જ આચાર રાખતો હોય તો કહેવા દો કે એની આંખો સામે રોજ રોજ પરચા થતા જ રહે છે. તમે અત્યારે આ ચોપડી વાંચી રહ્યા છો. હા, બરાબર આ જ ઘડીએ તમે ને તમારી ચોપડી, તમારી ઓરડી ને તમારું આખું ગામ અવકાશમાં કલાકના ૬૮,૪૦૦ માઈલની ભયંકર ઝડપે ધૂમી રહ્યું છે.

ને આટલી અકુલ્ય ઝડપ હોવા છતાં કશું લેશ નથી હાલતું કે નથી કોઈ પૃથ્વી પરથી ગબડતું કે ફુગોળાતું. તમે રાત્રે પથારીમાં ધસાધસાટ ઊંઘતા હો છો તે વેળાએય એ જ ગતિથી તમે ધૂમી રહ્યા છો, ક્ષાળનોય વધારો કે ઘટાડો નાહિ.

આને તો અવકાશવિદ્યા ધારી આગળ નીકળી ગઈ છે. મોટાં મોટાં અવકાશયાનો દૂર દૂરના ગ્રહો-ઉપાયહોમાં ધૂમતા થયાં છે. તેથી આ વિરાટ બ્રહ્માંડમાં આપાડી પૃથ્વી માગ એક નાનું ટપકું જ લાગે છે.

ગોવર્ધનરામ કહે છે તે પ્રમાણે આખું બ્રહ્માંડ ‘નભબિદુ’ છે એની આપાણને ખબર પડી છે. છતાં ખગોળવિદ્યામાં માણસા આને આટાટલું આગળ વધ્યો છે તોય બ્રહ્માંડનો પૂરો નક્શો એ દોરી શક્યો નથી, એની આંદ્રી સરહદ પાણ દોરી શક્યો નથી. ને માણસે બ્રહ્માંડની જે કંઈ નાનીસરખી સીમા આંકી છે ત્યાં આપાણે પહોંચવું હોય તો પ્રકાશવર્ધની ગાડાનારી મુજબ ક્ષાળાની ૧,૬૮,૩૦૦ માઈલની ઝડપ મુજબ ત્યાં પહોંચતાં દ લાખ વર્ષો તો સહેલાઈથી નીકળી જાય.

આ વિરાટ બ્રહ્માંડ એક રાક્ષસી કદની ધરિયાળ સમું છે. અનંત અવકાશમાં એ અદ્ભુત ઝડપે ને એકદમ ચોક્કસ ગતિએ ધૂમી રહ્યો છે. આજની અવકાશયાનોવાળી વેધશાળાઓની ધરિયાળો એકદમ ચોક્કસ હોય છે. તેમ છતાં તેમાંય પળના હજારમાં ભાગ જેટલી વધધટ તો થતી રહેતી હોય છે. તેથી એના કાંટા મેળવવા પડે જ છે. પાણ આ બ્રહ્માંડરૂપી વિરાટ ધરિયાળ લવલેશ આધુંપાછું થતું નથી. એને કેવા કુશળ ધરિયાળીએ ધડું હશે!

કોઈ રળિયામણી રાતે તમે પથારીમાં પડ્યા પડ્યા આકાશના તારાઓ જોયા હશે. પાણ તે વખતે તમે તે સમયના નાહિ બલ્કે ભૂતકાળના દ્રશ્યને જોઈ રહ્યા હતા તે તમે જાણો છો? જે તારાઓનો પ્રકાશ તમે જોઈ રહ્યા છો તે પ્રકાશ તે ઘડીનો નથી, બલ્કે હજારો કે લાખો વર્ષ પહેલાંનો છે. એ પ્રકાશને તમારી આંખો સુધી પહોંચતાં આટલા બધાં વર્ષો લાગ્યાં છે.

મોટાભાગના તારાઓનો પ્રકાશ આપણે જરૂરી તેના હજરો વર્ષો પહેલાં ત્યાંથી નીકળ્યો હતો. ને કરોડો માઈલોનું અંતર કાપતો કાપતો એ આપણા લગી પહોંચ્યો છે. આપણો આ સૂર્ય આપણાથી ફક્ત દર્દ વાખ માઈલ દૂર છે. તેના પ્રકાશને પણ આપણી પૃથ્વી પર પહોંચતાં બરાબર આઠ મિનિટ લાગે છે. પણ આપણી નજીકમાં નજીકના તારાના પ્રકાશને આપણી આંખો સુધી પહોંચતાં ચાર વર્ષો લાગે છે. આગણ જોયું તેમ પ્રકાશની ગતિ દર સેક્ઝન ૧,૬૮,૩૦૦ માઈલની છે. એ ગણતારી માંડીએ તો એ તારામાંથી નીકળેલું કિરણ દર વર્ષે છ અનુભૂ માઈલ કાપે. તે હિસાબે એ તારો આપણી પૃથ્વીથી ચોવીસા અબાજ માઈલ દૂર થયો.

પરચા પર પરચા

આજે તો મોટી વેધશાળાઓનાં પુસ્તકાલયોમાં છેલ્લામાં છેલ્લી ટ્યુનાં અવકાશવિજ્ઞાનને લગતાં પુસ્તકો ઉપલબ્ધ છે. ઇતાં આ પુસ્તકો પણ બ્રિંદાની લીલાને પૂરેપૂરી સમજાવી શકતાં નથી. આજની દુનિયાની ઊંઘ હરામ કરી નાખનાર આગુંબોબાની જ વાત લો. હેરેક સૂક્ષ્મ આગું એક એક નાનકડું વિશ્વ છે. આ નાનકડા આગુની આગુંબાજુ નિશ્ચિત ભ્રમણ કક્ષામાં એના નિશ્ચિત સંખ્યાના પરમાગુંઓ ધૂમતા રહે છે. એ પરમાગુંઓમાં ભારે વિનાશક શક્તિ ભરેલી પડી હોય છે. મહાસાત્તાઓની પાસેનાં આગુંશળો પૃથ્વીનો સાત વખત નાશ કરી શકાય એટલી પ્રયંક ધાતક તાકાત ધરાવે છે.